

ત્વરિત જાહેરાત માટે

ડાઉનટાઉન બ્રેમ્પટનમાં ઉદ્ભવી રહ્યા છે નતનવા સાર્વજનિક સ્થળો

બ્રેમ્પટન, ઓન્ટારિયો (04 સપ્ટેમ્બર 2020) – લાંબા વિકેન્ડે સમયસર – ડાઉનટાઉન બ્રેમ્પટન બિઝનેસ ઈમ્પ્રૂવમેન્ટ એરિયા સાથે ભાગિદારીમાં સીટી ઓફ બ્રેમ્પટન, રહેવાસીઓ અને મુલાકાતીઓ માણી શકે તે માટે ડાઉનટાઉનમાં રજૂ કરે છે બે નવા પાર્કલેટ્સ.

ભૌતિક અંતર જાળવવા અને સલામતીના પગલાં રૂપે સિટીએ ત્રણ પાર્કિંગ જગ્યાઓને જાહેર બેઠકો ધરાવતા ક્ષેત્રોમાં રૂપાંતરિત કરી છે જ્યાં ભરપૂર વિલોતરી વચ્ચે રહેવાસીઓ સુરક્ષિત રીતે ઢળીમળી શકે. બે પાર્કલેટ્સ 38 અને 40 મેઈન સ્ટ્રીટ નોર્થ ખાતે અને 64 મેઈન સ્ટ્રીટ નોર્થ (વિવિઅન લેન સામે) ખાતે સ્થિત છે.

આ માળખા નવેમ્બર 1 સુધી રહેશે.

સપોર્ટ લોકલ બ્રેમ્પટન

સ્થાનિક વ્યવસાયો પર COVID-19 નો નોંધપાત્ર પ્રભાવ પડ્યો હોવાથી તેમને બ્રેમ્પટનના સમાજ પાસેથી ક્યારેય જરૂર ન પડી હોય એટલી મદદની આવશ્યકતા છે. મે માસમાં બ્રેમ્પટન સીટી કાઉન્સિલે બ્રેમ્પટનના [અર્થતંત્રને ફરી બેઠું કરવાના વ્યુહ \(Economic Recovery Strategy\)](#) ને મંજૂરી આપી હતી જેમાં નાના વ્યવસાયો, રેસ્ટોરન્ટો અને પ્રવાસનને મદદરૂપ થતા પગલાંનો સમાવેશ થાય છે. આજ દિન સુધી સિટીએ અનેક પહેલો રજૂ કરી છે જેમાં સમાવેશ થાય છે *સપોર્ટ લોકલ બ્રેમ્પટન* અભિયાન અને *પેશિયો બ્રેમ્પટન* પ્રોગ્રામ. શક્ય હોય ત્યાં રહેવાસીઓને ખરીદી કરવામાં, બહાર ખાવામાં અને ઉપહારો આપવામાં સ્થાનિક વ્યવસાયોને સપોર્ટ કરવા (સપોર્ટ લોકલ) પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અવતરણો

“COVID-19 સામેના સિટીના એકંદર પ્રતિભાવમાં અમે પ્રોગ્રામિંગ, સેવાઓ અને સ્થળોને એવી રીતે પરિવર્તિત કર્યાં છે જેથી રહેવાસીઓ અને વ્યવસાયોને મદદરૂપ થઈ શકાય. વિસ્તારિત પેશ્યોની જગ્યાઓથી લઈને આ નવા પાર્કલેટ્સ સુધી અમે હંમેશા નવા માર્ગો શોધતા રહ્યા છીએ જેથી લોકો બ્રેમ્પટન આપી શકે એવી બધી શ્રેષ્ઠત્તમ બાબતો માણી શકે. ડાઉનટાઉનમાં આ નવી આઉટડોર જગ્યાઓ બરાબર ત્યારે જ સમયસર અસ્તિત્વમાં આવી જ્યારે સપ્તાહના અંતે લાંબી રજાઓ છે અને હું બધાંને તે સુરક્ષિત રીતે માણવાનું આલ્વાન કરું છું.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન BIA આ પરિયોજનામાં તમારી ભાગીદારી માટે તમારો આભાર. રહેવાસીઓ જ્યારે સ્થાનિક ડાઉનટાઉન વ્યવસાયોની મુલાકાત લે ત્યારે નવા સુરક્ષિત જાહેર સ્થળોનો લાભ લઈ શકે તેમાં આ નવા પાર્કલેટ્સ આપણા સિટીના પુનઃપ્રારંભ અને પુનઃઉત્થાન વ્યુહમાં મદદરૂપ થશે."

- માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રિજનલ કાઉન્સિલર, વોર્ડ 3 & 4 પ્રમુખ, મેયર્સ રિઓપનિંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ, સિટી ઓફ બ્રમ્પટન

"આ મહામારી દરમિયાન અમને અમારા કર્મચારીઓ, રહેવાસીઓ અને વ્યવસાયોની પ્રતિબદ્ધતા, કંઈક નવું કરવાની ઈચ્છા અને તેમના એકબીજા માટેની ભાવનાના બખૂબી દર્શન થયા છે. તેઓએ આપણી સહિયારી ફરી બેઠા થવાની ભાવના અને એકબીજાને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પાયલટ પ્રોગ્રામ આ જ ભાવનાને કેદ કરે છે અને આ પાર્કલેટ્સ આપણા ડાઉનટાઉનમાં ઊભી થઈ છે તેનો મને આનંદ છે."

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રમ્પટનના પ્રમુખ

"આ નવા પાર્કલેટ્સ એટલે આપણા શહેરને સુરક્ષિત અને અર્થપૂર્ણ રીતે ફરી બેઠું કરવા માટે રહેવાસીઓ, વ્યવસાયો અને સ્થાનિક હિસ્સાધારકો સાથે પ્રવૃત્ત થઈને ગાઢ સહયોગનું સીધું પરિણામ છે. હું ડાઉનટાઉન બ્રમ્પટન BIAના અમારા ભાગીદારો અને સિટીની ટીમનો સહયોગપૂર્વક આભાર વ્યક્ત કરું છું જેમણે આપણા રહેવાસીઓ અને મુલાકાતીઓને માણવા માટે આ જગ્યાઓને પરિવર્તિત કરી."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

"ડાઉનટાઉન બ્રમ્પટન BIA સિટી ઓફ બ્રમ્પટનના શહેરી ડિઝાઇન ગ્રૂથ (Urban Design Group)ના ડાઉનટાઉન માટેના સંખ્યાબંધ રિકવરી કાર્યક્રમોમાં સહયોગ કરી રહ્યું છે અને તેઓ મેઈન સ્ટ્રીટ નોર્થનો પાયલટ પાર્કલેટ્સ પ્રોગ્રામ આકાર લઈ શક્યો જેનાથી જાહેર ક્ષેત્રમાં જીવ ફૂંકી શકાયો અને તે પ્રવૃત્તિમય થઈ શક્યું તેનો આનંદ વ્યક્ત કરે છે."

- સુઝી ગોડફ્રોય, એગ્રિક્યુલ્ચરલ ડિરેક્ટર, ડાઉનટાઉન બ્રમ્પટન ક્ષેત્ર (BIA)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કરી કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સિટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca